

B.Sc. (HS) Semester - 6 (CBCS) Examination**May/June-2021 (NEW COURSE)****Community Health & Nutrition Program & Policies (Core)****Time: 1:30 Hours****Marks: 30****Instructions:**

1. Figures to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

-
- પ્રશ્ન.૧ પ્રોટીન, એનર્જી માલન્યુટ્રીશન (PEM) થવાના કારણો, પ્રકાર અને અટકાવ વિશે ચર્ચા કરો. (૧૦)
- પ્રશ્ન.૨ મધ્યાહન ભોજનના હેતુઓ, મહત્વ અને મેનુ વિશે સમજાવો. (૧૦)
- પ્રશ્ન.૩ નેશનલ અર્બન હેલ્થ મીશન વિશે સમજાવો. (૧૦)
- પ્રશ્ન.૪ W.HO. ના કાર્યો વિશે સમજાવો. (૧૦)
- પ્રશ્ન.૫ કોઈપણ બે ટુંકનોંધ લખો. (૧૦)

1. CARE
2. ડાયાબીટીસ થવાના કારણો.
3. સીએફટીઆરઈ દ્વારા ભારતીય બહુખાદાનો હેતુ
4. કોરોનરી હાર્ટ ડીસીજ ના અટકાવાના પગલા

ENGLISH VERSION

- Q.1 Discuss about cause, types and prevention of protein energy malnutrition. (10)
- Q.2 Explain about the goals, importance and menu of Mid-Day Meal. (10)
- Q.3 Explain National urban health mission. (10)
- Q.4 Explain function W.HO. (10)
- Q.5 Write any two short notes. (10)

1. CARE.
2. Etiology of diabetes.
3. Indian Multi purpose food by CFTRI.
4. Steps to be taken to prevent coronary heart disease.
